

BUSINESS મિત્ર Plus

ચોમેર રાજકીય અરાજકતા વધતા સોનાચાંદીમાં સ્ફોટક તેજ- ફેડની સ્વતંત્રતા ખતરામાં

અમેરિકન ફેડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રભાવ વધશે અને આગળ પર મોટા રેટકટ આવશે, લિક્વિડિટીની રેલમથક વધતા શેરબજાર, બુલિયન પ્રાઈવેટ એસેટ, ક્રિપ્ટો, એઆઈ ડિજિટલ એસેટ એમ જાતેજાતની રિસ્કી એસેટમાં તેજનો મેનિયા છવાઈ ચૂક્યો છે. બુધવારે ફેડની બેઠકમાં પા ટકા રેટ કટ તો નક્કી જ છે. પણ ફેડના ગવર્નર લીઝા કુકને હટાવવામાં તેમજ ટ્રમ્પના ટેકેદાર મિરાનને ગવરનર બનાવવામાં ટ્રમ્પ સફળ થાય તો ઝડપી મોટા રેટ કટ આવશે. ફેડનું આર્થિક સ્વાતંત્ર્ય જોખમાય તો ડોલર પર ભરોસો તૂટી જાય એવી અટકળે મોટી કેમ્બ્રિય બેન્કી, મોટા હેજફંડો ડોલર વેચી સોનું લેવા લાગ્યા છે. સાઉદી અરેબીયા અન રશિયાએ ડોલર માટે સોનું ઉપરાંત ચાંદી પણ લેવાનું શરૂ કર્યું છે. ચાઇના, અમેરિકા, યુરોપમાં રિટેલ ઇનવેસ્ટરો ચાંદીના ઈટીએફમાં રોકાણ વધારી રહ્યા છે. સોનું 3660, ચાંદી 42.50 ડોલર અને ઘરઆંગણે સોનું 110000, ચાંદી 129000ના સર્વોચ્ચ સતરે પહોંચ્યા છે. અમેરિકામાં ટ્રમ્પના ચૂસ્ત સમર્થક અને ટર્નિંગ પોઈન્ટ અમેરિકાના સ્થાપક ચાર્લી કર્કની હત્યાથી અમેરિકામાં વિચારધારાની લડાઈમાં હિંસાનું તત્વ વધતા સોનામાં રિસ્ક પ્રિમિયમ વધ્યું છે. ઈઝરાયેલ વોર પીમેપીમે મોટા અખાતી સંઘર્ષમાં પલટાઈ રહી છે. રશિયા-યુક્રેન યુધ્ધ પણ વધ્યું છે. અને રશિયા-નાટો

વચ્ચે તંગદીલી સશસ્ત્ર તનાવમાં પલટાય એવા અંધાણ છે. પોલેન્ડમાં રશિયન ડ્રોન આવ્યા પછી પોલેન્ડે નાટો આર્ટિકલ 4 ઈન્વોક કર્યો છે. જે રશિયન ઘ્રીટ માટે સભ્યોએ શુ કરવું એની ઔપચારીક શરૂઆત છે. ઈન્ડોનેશિયા, ફ્રાન્સ, નેપાલમાં રાજકીય દેખાવો અને ટેરરર રાજકીય અરાજકતા વધી છે. ડોલરમાં નરમાઈ અને સ્વિસ ફ્રાન્ક તેમજ સોનાની તેજ રિસ્ક પ્રિમિયમને રિફ્લેક્ટ કરે છે.

શેરબજારોની વાત કરીએ નાસદાક, ડાઉ, જાપાની નિકકાઈ, તાઈવાન શેરબજાર સહીત ટેકનોલોજી સેન્ટ્રિક શેરોમાં વિક્રમી તેજ છે. એઆઈ-ડિજિટલ ફિન્ટેક બુમને કારણે એઆઈમાં વેન્ચર કેપિટાલીસ્ટ, ક્રિપ્ટો-ડિજિટલ સેક્ટરમાં હોટમનીનો

અમેરિકામાં આક્રમક રેટકટની આશાએ શેરબજાર, ઇમર્જિંગ ફોરેક્સ-ઓલ્ટકોઇનમાં તોફાની તેજ

મેડરશ છે. ઓલ્ટ કોઈન (ઈથર, સોલાના) મેમે કોઈન જેવા કે ડોજ શિબા, નેરેટિવ કોઈન (દાખલા તરીકે વર્લ્ડ લિબર્ટી) જેવા લાખો ટોકન ઈસ્યુ થતા રહે છે. ડિજિટલ એસેટમાં ટોકનાઈઝ્ડ શેરો પણ ગણીએ તો અત્યાર સુધીમાં અંદાજે 35 લાખ ટોકન ઈસ્યુ થઈ ગયા છે. બીટકોઈન અને ઈથર તો ઘણા ખરા રેગ્યુલેટેડ પલટાઈ રહી છે. રશિયા-યુક્રેન યુધ્ધ પણ વધ્યું છે. અને રશિયા-નાટો



સ્થાનિક બજારોની વાત કરીએ તો સેન્સેક્સ 82000 નજીક અને નિકટી ફરી 25000ને પાર પહોંચ્યા છે. જીએસટી કટ પછી વપરાશમાં વેગ આવશે. અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં સમજૂતીની આશા વચ્ચે સિલેક્ટ ડિકેન્સ, આઈટી, ઈન્ફ્રા, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં ડીપ

આશાવાદ છે.

કરન્સી બજારોમાં વોલેટાલીટી સતત વધતી જાય છે અને હવે એ ન્યુ નોર્મલ છે. લાંબા સમયની શાંતી પછી હવે વિવિધ કરન્સીઓ વચ્ચે એલાઈન્મેન્ટ- રિએલાઈન્મેન્ટ થઈ રહ્યા છે. ડોલર ઈન્ડેક્સ ધીમે ધીમે 110થી ઘટીને 97 થઈ ગયો છે. બ્રિક્સ કરન્સીમાં બ્રાઝિલ રિઆલ 6.30થી વધી 5.35, યુઆન 7.3થી

બિરેન વકીલ

વધી 7.12, રશિયા રુબલ 110થી વધી 80 થઈ ગયા છે. બ્રિક્સ કરન્સીમાં માત્ર રૂપિયો જ નબળો પડ્યો છે જેમાં મુખ્ય કારણ ભારત-અમેરિકા વચ્ચેની ટેરિફવોર છે. મુખ્ય ચલણોમાં યુરો અને સ્કેન્ડિનેવિયાની કરન્સીમાં શાનદાર તેજ છે. યુરોપિયન ચલણોમાં સ્વિસ ફ્રાન્ક ટોપ લીડર છે. ડોલર સામે ફ્રાન્ક 0.97થી વધી 1.25 થયો છે. યુરોપ અને યુકેમાં રાજકીય અને આર્થિક કમજોરી વચ્ચે પણ યુરો અને પાઉન્ડ મજબૂત રહ્યા છે જેનું

મુખ્ય કારણ ફ્લાઈટ ટુ સેફ્ટી- સેફ હેવન અપીલ ગણાય. સ્કેન્ડિનેવીયન કરન્સી સ્વિડીશ ગ્રોના કે નોર્વે કોનર પણ ઘણા મજબૂત છે. એશિયામાં તાઈવાન ડોલર, થાઈ ભાત અને મલેશિયા રિંગીટ પણ મજબૂત છે.

કોમોડિટીઝ બજારોમાં મેટલ્સમાં બજાર દીશાહીન છે. કોપર લાંબા સમયથી 880-910ની રેન્જમાં લોક છે. એલ્યુ અને ઝિંકમાં બેતરફી વધઘટે ધીમી તેજ છે. કુડઓઈલમાં તેમજ ગેસમાં ધીમો ઘસારો છે. અકારણ વધઘટ આવ્યા કરે છે પણ ટ્રેન્ડ કમજોર છે. નિકલમાં પણ સતત કમજોરી છે. એગ્રીકોમોડિટીઝમાં ચણા-તુવેરમાં કારમી મંદી છે. તુવેરના ભાવો 4500 આસપાસ છે. ટેકાનો ભાવ 8000 છે. મગફળી અને સોયાબીન પણ ટેકાના ભાવથી નીચા છે. કપાસ, કઠોળ, સોયાબીન બજારો સરકારી એમએસપી ખરીદીના ઓશિયાળા દેખાય છે. હાલમાં ખરિફ પાકોમાં અડડ-જૂવાર બાજરી, ઘાસચારો, એરંડાને નાનું મોટું નુકસાન છે. પણ એકંદરે વરસાદની પુરાંત હોઈ વેધર સારુ રહે તો ખરિફમાં પાકો આશાસ્પદ દેખાય છે. રવી પાકો માટે પુરતા પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. મસાલા પાકોમાં જીરૂમાં કારમી મંદી અને હળદરમાં ધીમી મંદી છે. નવી સિઝનમાં રાયડો, વરીયાળી, પાણા હોટેલવરીટ રહેશે. જીરુ, પાણા, ચણાને ગત વરસ કરતા ઓછું એકરેજ મળશે.

2047 સુધીમાં ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ 10 ટ્રિલિયન ડોલરનું થઈ જશે

ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાલમાં માંગમાં ઘટાડો જોવાયો છે. વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવી માંગ સપાટ રહી છે, પણ ઘટાડો પણ જોવાયો નથી. જેના લીધે ભાવ સ્થિર થઈ રહ્યા છે. જેના પરિણામે આવનારા દિવસોમાં નવેસરથી માગ નીકળશે તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજીની માગ નીકળી શકે છે. આગામી બે દાયકાની વાત કરીએ તો ભારતીય અર્થતંત્ર જે સ્પીડે વધી રહ્યું છે તે સ્પીડને જોતાં રિયલ એસ્ટેટ



સેક્ટરમાં પણ તેજીનો દોર જોવા મળશે.

વધતી માંગ, વધતા સંસ્થાકરણ અને મજબૂત આર્થિક વિકાસની સંભાવનાઓને પગલે ભારતમાં 2047 સુધીમાં કુલ ઓફિસ સ્પેસ 2 અબજ ચોરસ ફૂટને પાર થવાની સંભાવના છે. ઉપરાંત, રિયલ એસ્ટેટ સેક્ટરનું બજાર 2047 સુધીમાં 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.

કોલિયર્સ કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-કેડાઇના સહયોગથી એક અહેવાલમાં



જણાવ્યું હતું કે ભારતમાં 'ગ્રેડ એ' ઓફિસનો સ્ટોક 2010થી ત્રણ ગણો વધીને 800 મિલિયન ચોરસ ફૂટથી વધુ થઈ ગયો છે. આ વૃદ્ધિ ગ્લોબલ કેપિટાલિટી સેન્ટર્સ (જુસીસી) અને ટેકનોલોજી, બીએફએસઆઈ, એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં સ્થાનિક કંપનીઓની વધતી માંગને કારણે પ્રેરિત છે. સિંગાપોરમાં કેડાઇ નેટકોન ઇવેન્ટમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રની ઝડપી ગતિએ વૃદ્ધિ એસેટ વર્ગોમાં બહુપક્ષીય વૃદ્ધિને આભારી છે. આ ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન, માળખાગત વિકાસ અને

ટેકનોલોજી તેમજ ટકાઉપણું પર વધતા ધ્યાન દ્વારા પ્રેરિત છે. ભારતીય રિયલ એસ્ટેટ જે વિશાળ સ્થિતિક વૃદ્ધિ જોઈ રહ્યું છે તે 1990ના દાયકાથી સ્થાનિક ઉદ્યોગમાંથી વિકસિત થયું છે. ત્યારથી, જીડીપીમાં તેનું યોગદાન 2000ના દાયકાની શરૂઆતમાં 5 ટકાથી નીચે હતું તે આજે 6થી 8 ટકા સુધી સતત વધી રહ્યું છે.

સૌથી સારી વાત એ છે કે આ વૃદ્ધિ 2047 સુધીમાં 14થી 20 ટકા સુધી પહોંચવાની ધારણા છે. આંકડાઓની વાત કરીએ તો, વૃદ્ધિ લગભગ 10 ટ્રિલિયન યુએસ ડોલર હશે. રહેણાંક મકાનોનું વેચાણ

2025માં 0.4 મિલિયન યુનિટથી વધીને 2047 સુધીમાં એક મિલિયન થવાનો અંદાજ છે.

અહેવાલ મુજબ, ભારત પહેલાથી જ વૈશ્વિક સ્તરે ચોથા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને 2047 સુધીમાં સંભવિત રીતે 35થી 40 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે, જે વૈશ્વિક કાળા સ્થાન ઘટનાઓ દ્વારા વિકાસ ગતિ અટકાવવામાં ન આવે. ઓઊગિક અને વેરહાઉસિંગ ક્ષેત્રમાં, ગ્રેડ એ સ્ટોકનું સ્તર 2025માં 250 મિલિયન ચોરસ ફૂટને વટાવી ગયું છે, જે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર

શહેરીકરણ કરી રહ્યા છે. 2050 સુધીમાં, કુલ વસ્તીના 53 ટકા શહેરી વિસ્તારોમાં રહેતા લોકો હશે, જે હાલમાં 37 ટકા છે.

કોલિયર્સ ઇન્ડિયાના નેશનલ ડિવેલપર અને હેડ ઓફ રિસર્ચ બિમલ નાદરે જણાવ્યું હતું કે, ભારત માત્ર તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યું નથી; પરંતુ શહેરી જીવનના ભાવિની ફરીથી કલ્પના કરવી. ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર તમામ એસેટ ક્લાસમાં ઝડપી ગતિએ બહુ-પરિમાણીય વૃદ્ધિ માટે સજ્જ છે. સતત સરકારી પ્રોત્સાહન અને સંખ્યાબંધ ખાનગી

વિકાસ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને ગ્રાહકની માંગ તેમજ વેરહાઉસિંગની જરૂરિયાતોમાં વધારાને કારણે 2010ના સ્તરની યુલનામાં અનેકગણો વધારો થયો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આવકના સ્તરમાં અંદાજિત વધારો અને પ્રગતિશીલ આવાસ નીતિઓના સમર્થન સાથે, વાર્ષિક આવાસ વેચાણ 2047 સુધીમાં બમણું થઈને એક મિલિયન યુનિટ થઈ શકે છે. ભારતીય શહેરો ઝડપથી

અને જાહેર હિતધારકો સાથે, ભારત 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. એટલું જ નહીં, ભારતીય અર્થવ્યવસ્થા 2047 સુધીમાં 35-40 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.

આ આર્થિક પરિવર્તનનું મૂળ કારણ જીડીપીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના યોગદાનમાં સતત વધારો છે, જે 2000ના દાયકાની શરૂઆતમાં 5 ટકાથી વધીને આજે 6-8 ટકા થયો છે અને તે 14-20 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આવકના સ્તરમાં અંદાજિત વધારો અને પ્રગતિશીલ આવાસ નીતિઓના સમર્થન સાથે, વાર્ષિક આવાસ વેચાણ 2047 સુધીમાં બમણું થઈને એક મિલિયન યુનિટ થઈ શકે છે. ભારતીય શહેરો ઝડપથી

એકઠાઈઆઈની વેચવાલી રહી છે, તે બંધ થશે અને નવેસરથી ખરીદી શરૂ થશે, જે બજારને નવો જોશ પુરો પાડશે અને ભારતીય શેરબજાર નવી તેજીની શરૂઆત થશે અને ઐતિહાસિક સપાટીને વટાવી દેશે. એડવાન્સેજ ઈન્ડિયા હોય વિદેશી રોકાણકારો સતત વેચવાલ રહ્યા માટે વધતા મહત્વ અને યુરોપના દેશો સાથે પણ ભારતની ટ્રેડીલ સંજોગોમાં મેક ઈન ઈન્ડિયા સાથે ભારતમાં ઔદ્યોગિક વૃદ્ધિ વેગ પકડતી જોવાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કોર્પોરેટ ઈન્ડિયાના ટાયકૂનોની તાકાતથી અમેરિકા પણ ભારત સાથે ભારતની ફેવરમાં ડીલ કરવા આગળ આવીને સમજૂતિ કરે તો નવાઈ નહીં, જેથી શેરોમાં અત્યારે કોઈપણ કંરેકશન તથા સારા શેરોમાં ખરીદી કરવાની તક ઝડપી લેવી જોઈએ. આઈટી સેક્ટરમાં ઈન્ફોસીસના મેગા



રોકાણકારોની સતત ખરીદી થઈ રહી છે, જે પોઝિટિવ સાઈન સાથે સારા શેરોમાં રોકાણકારોને ફરી પોઝિટિવ વળતર મળવા લાગ્યું છે, પણ શેરબજારમાં અરેબર તેજ ત્યારે આવશે જ્યારે વિદેશી રોકાણકારો પરત ફરે. ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા લાંબા સમયથી

FAની વેચવાલી અટકશે, અને નવી લેવાલી શરૂ થાય તો શેરબજાર ઐતિહાસિક તેજ જોવા મળશે

વિશ્વમાં જીઓ પોલીટીકલ ટેન્શન ચાલુ જ છે, પણ ટેરિફ વોર શાંત થવાના આશાવાદે ભારતમાં શેરબજારમાં ફરી એકવાર તેજીનો દોર શરૂ થવા પામ્યો છે. જીઓ પોલીટીકલ ટેન્શન પુરૂ થયું નથી, ત્યાં વિશ્વમાં સત્તા પલટવાનું સંકટ ઉભું થયું છે. છેલ્લા સપ્તાહમાં ત્રણ દેશોના પ્રધાનમંત્રીઓએ

પણ સંબંધો સુધારતા નિપુટી બની રહી છે અને તેના લીધે અમેરિકાના પેટમાં તેલ રેળાઈ છે. જોકે, અમેરિકાએ ભારતમાં ટેરિફ વોર શરૂ કર્યા બાદ પુનઃ વાટાઘાટો કરીને ટેરિફ વોર શાંત પાડવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. અમેરિકા નરમ પડવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે અમેરિકા એક બાજુ નરમ થવાની વાતો

અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલમાં ટેરિફમાં રાહત થશે તો શેરબજારમાં મજબૂતાઈ આગળ વધશે, અમેરિકા સાથે વાટાઘાટો પુનઃ શરૂ થવાના અહેવાલ બજારને જોશ આપશે

રાજીનામાં આપવા પડ્યા છે, જ્યારે બાગલાદેશ, શ્રીલંકા તેમજ નેપાળમાં તપ્તો પલટાને લઈ વિશ્વમાં અશાંતિ વધી રહી છે.

અમેરિકાના ટેરિફ વોરના કારણે રશિયાની સાથે ચીન બાદ હવે ભારત

કરે છે, બીજી તરફ, નાટોને ભારત ઉપર 100 ટકા ટેરિફ લગાવવાની સલાહ આપે છે. આમ, ટ્રમ્પનો બે મોંઢાની વાત કરી રહ્યો છે, તેના નિર્ણય પર આવનારા દિવસોમાં બજારની ચાલ જોવા મળશે. ઘરેલુ સ્તરે ટેરિફ વોર સામે ભારત

તેજનો પવન દેખાયો છે, જો કે બજારને સ્થિર થતાં હજી થોડો સમય લાગશે

લાલ સ્ટ્રીટે ૧૨ સપ્ટેમ્બરના રોજ સતત આઠમા સપ્તમાં પોતાનો ઉત્સાહનો દોર લંબાવ્યો, જેમાં ૨૩ જુલાઈ પછી પહેલી વાર નિકટી ૫૦ ૨૫,૧૦૦ ની ઉપર બંધ રહ્યો. સેન્સેક્સ ૩૫૬ પોઈન્ટ વધીને ૮૧,૮૦૪.૭૦ થયો, જેના કારણે લગભગ ત્રણ મહિનામાં સૌથી મજબૂત સાપ્તાહિક ઉછાળો નોંધાયો કારણ કે બંને બેન્ચમાર્ક ૧.૫ ટકા વધ્યા. સેક્ટરલ મજબૂતાઈ ઓટો, ફાર્મા, મેટલ્સ અને ટેલિકોમમાંથી આવી, જેમાં દરેકમાં ૧ ટકાનો વધારો થયો, જ્યારે રિયલ્ટી, એફએમસીજી, મીડિયા અને પીએસયુ ઓંકો ઘટ્યા. આ શુક્રવારે અમારી આશાઓને ફરીથી મજબૂત વેગ મળ્યો કારણ કે નિકટીએ કેટલાક સાપ્તાહના અંતે પ્રોફિટ બુકિંગ છતાં હકારાત્મક રહ્યો છે અને તેણે થોડી રિવાઇલ્ડ આ દશાવ્યું છે અને કેટલીક પ્રોત્સાહક

ગતિવિધિઓ ઉત્પન્ન કરવા માટે થોડો વધારો કરવાનું ચાલુ રાખ્યું છે.

અહીંથી આગળ વધવાથી નિકટી 25400 ની આસપાસ તેના આગામી લક્ષ્યાંકો તરફ આગળ વધી શકે છે જે અગાઉનું ઉચ્ચ સ્તર પણ છે. આ સ્તર મધ્ય રેખા સાથે બોડાઈ રહ્યું છે અને આ નિકટી માટે એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે.

એકંદરે, બજાર એક રસપ્રદ તબક્કે સજ્જ છે કારણ કે વિદેશી તેમજ સ્થાનિક મેક્રો આંકડાઓમાંથી કેટલાક પ્રોત્સાહક સમાચાર પ્રવાહ સાથે વલણોએ વેગ પકડ્યો છે જે સૂચવે છે કે આપણે બજારની મજબૂતાઈ માટે રિકવરી તરફ જોઈ શકીએ છીએ. વપરાશની થીમને વેગ આપવા માટે સરકાર દ્વારા નવી પહેલોને પણ સારી સફળતા જોવા મળી છે. તહેવારોની મોસમ પહેલા ઉભરી રહેલા સ્થિર ટેઇલવિન્ડ્સ આ હેતુને મદદ કરી શકે છે.

અમે નોંધ્યું છે કે મિડ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદીમાં સતત રસ જોવા મળી રહ્યો છે અને અગ્રણી નામોમાં સતત સુધારો અમને તેજીનો વિશ્વાસ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. એક મુખ્ય કારણ એ છે કે ઓંક નિકટી સ્થિર રહ્યો છે અને તેણે થોડી રિવાઇલ્ડ આ દશાવ્યું છે અને કેટલીક પ્રોત્સાહક




નીઓટ્રેડર

ફાયનાન્સની દુનિયામાં રહો આગળ!

જો તમે શેરબજારમાં રિયલ ટાઈમ આંતરસૂચ સાથે ટ્રેડિંગ કરવા માંગતા હોવ તો જોડાઓ નિઓટ્રેડર દ્વારા સંચાલિત ટેલિગ્રામ એડવાઈઝરી, CFO ગેઇન્સમાં. તો આ એડવાઈઝરીનો વિશેષ એક્સેસ મેળવવા ફક્ત નીચેની લિંક પર જાઓ અથવા અહીં આપોલો QR કોડ સ્કેન કરી તમારી વિગતો ભરો...

<https://bit.ly/3Z9gg5v>



(લેખક ડૉ. સી.કે. નારાયણના નેજા હેઠળ 10થી વધુ વર્ષોના અનુભવી છે અને ચાર્ટ વડે દર અઠવાડિયે ચોક્કસ ભલામણ આપશે)

ડિસ્ક્લેમર: આ ફક્ત 'ગુજરાતમિત્ર'ના વાચકોની માહિતી માટે છે અને તે કોઈ રોકાણની સલાહ નથી. આ માહિતીના આધારે તમારા દ્વારા લેવાયેલા કોઈ પણ પગલા માટે તમારી જ જવાબદારી રહેશે. ગુજરાતમિત્ર, ચાર્ટ એડવાઈઝરી કે તેની સંલગ્ન કંપનીઓ અને કન્સાઈડરો તમારા દ્વારા લેવાયેલા આવા કોઈપણ પગલામાંથી ઉત્પન્નતા સંભવો માટે કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં.

શેરબજાર અંગેના પ્રશ્નો લખી મોકલો ગુજરાતમિત્ર ભવન, સોની ફળિયા, સુરત-3ના સરનામા પર અથવા ઇમેઇલ કરો અમને chartadvise@gujaratmitra.in પર